

Date: 15th November, 2022

To, BSE Limited PhirozeJeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400001

Dear Sir/Ma'am,

Sub: Newspaper Advertisement of extract of Unaudited Financial Results for the Quarter ended on 30th September, 2022

Ref: Security Id: MUNCAPM / Code: 511200

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement on 15th November, 2022 of Unaudited Financial Result for the Quarter ended on 30th September, 2022 in:

1. English Newspaper - Indian Express Newspaper and

2. Regional Language Newspaper (Gujarati) - Financial Express Newspaper

Kindly take the same on your record and oblige us.

Thanking You.

Yours Faithfully,

For, Munoth Capital Market Limited

Bhagyashree Jasmin Sutaria Company Secretary

PSPCL Punjab State Power Corporation Limited

Regd Office: PSEB Head Office, The Mall, Patiala - 147001 CIN: U40109PB2010SGC033813, Website: <u>www.pspcl.in</u> (Contact No. 96461-22185) Tender Enquiry No. 270/SS(D)-338/Spares Dated: 14.11.2

Dated: 14.11.2022 SE/Substation Design/TS Organization, C-1, Shakti Vihar, PSPCL, Patiala invites E-Tender for Manufacturing, Testing, Supply & Delivery (F.O.R. Destination at any place in Punjab) of Marshalling Boxes of vari-

bus types.
For Detailed NIT & Tender Specification please refer to https://eproc.punjab.gov.in from 16.11.2022 (11.00 A.M. onwards). NOTE: Corrigendum & amendments, if any will be published online a https://eproc.punjab.gov.in. C-435/22

MUNOTH CAPITAL MARKET LIMITED CIN: L99999GJ1986PLC083614

Regd. Office: Shanti Nivas, Opp. Shapath-V, Mr. Karnavati Club, S G Road, Ahmedabad-380058 E-mail: munoth@gmail.com; • Contact No.: 022-22843144, 22870278, 26937954

			(Rs. In Lakhs	except EPS)
Sr. No.	Particulars	Quarter Ending on 30.09.2022	Year to Date Figures 31.03.2022	Corresponding Three Months Ended in the Previous Year 30.09.2021
1	Total income from operations (net)	6.87	33.35	7.60
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-1.56	13.49	2.94
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	-1.56	13.49	2.94
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-1.56	13.49	2.94
5	Total Comprehensive income for the period (Comprising Profit for the period (after Tax) and other Comprehensive income (after Tax)	-2.78	16.01	3.07
6	Equity Share Capital	449.55	449.55	449.55
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year)	36.71	38.18	29.07
8	Earnings Per Share (before and after extraordinary items) Basic / Diluted:	-0.02	0.15	0.03
9	Face Value of Equity Share Capital	5	5	5

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBÍ (Listing and Othe Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e www.bseindia.com and company website www.munoth.com

For, Munoth Capital Market Limited Date: 14-11-2022 Siddharth Jain Director (DIN: 00370650) Place: Ahmedabad

JAMNAGAR UTILITIES & POWER PRIVATE LIMITED

gistered Office: CPP Control Room, Vi∎age Padana, Talu District Jamnagar - 361 280, Gujarat Phone: 022-35557100 • Email: debenture.investors@juç none: 022-35557100 • Email: debenture.investors@jupl.co.in Website: www.jupl.co.in • CIN: U40100GJ1991PTC051130

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER 2022

Sr.		Quarter	Ended	Year Ended
or. No.	Particulars	30 Sep' 22	30 Sep' 21	31 Mar' 22
NO.		Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	1,210.20	1,169.50	4,627.05
2	Net Profit before Tax	818.11	708.56	2,819.45
3	Net Profit after Tax	698.08	715.04	2,372.50
4	Total Comprehensive Income	693.18	711.07	2,353.32
	[Comprising Profit (after tax) and Other Comprehensive Income (OCI) (after tax)]			
5	Paid up Equity Share Capital	2,720.69	183.25	183.25
6	Reserves (excluding Revaluation Reserve)			14,554.41
7	Securities Premium Account	-	994.63	994.63
8	Net worth	24,783.17	18,521.62	19,484.84
9	Paid up Debt Capital / Outstanding Debt	17,436.22	15,396.28	18,673.11
10	Outstanding Redeemable Preference Shares	5,000.00	5,000.00	5,000.00
11	Debt Equity Ratio	0.89	1.12	1.27
12	Earnings Per Share (EPS) for the period / year - Class 'B' Equity Shares of face value of Re. 1/- each (refer Note 4)			
	- Basic and Diluted (in Rupees)	0.26	0.26	0.87
13	Debenture Redemption Reserve	1,281.25	1,281.25	1,281.25
14	Debt Service Coverage Ratio	2.02	2.07	2.01
15	Interest Service Coverage Ratio	3.30	3.88	3.40

- otes:

 The above is an extract of the detailed format of the Unaudited Standalone Financial Results for the quarter ended 30th September 2022 filed with the Stock Exchange under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results for the quarter ended 30th September 2022 are available on the website of BSE Limited (www.bseindia.com) and can be accessed on the Company's website (www.byulpt.co.in).

 For the other line items referred in Regulation 52(4) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to BSE Limited (www.bseindia.com) and can be accessed on the Company's website (www.listo.in).
- The Audit Committee has reviewed, and the Board of Directors has approved the above
- results and its release at their respective meetings held on 14th November 2022. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results. The Company has issued and allotted 2537,44,16,844 Class B Equity Shares of Re. 1 each as fully paid-up bonus equity shares, by capitalizing the reserves, to the existing Class 'B' Equity Shareholders on 26th May 2022. The Earnings Per Share figures for the quarter ended 30th September 2021 and year ended 31st March 2022 have been restated to give effect to the allotment of the bonus shares, as required by IND AS-33.

For Jamnagar Utilities & Power Private Limited Satish Parikh

SIKKA PORTS & TERMINALS LIMITED Registered Office: Admin Building, MTF Area, Village Sikka

Date: 14th November 2022

Taluka & District Jamnagar - 361140, Gujarat, India. Phone: 022-35557100 • Email: debenture.investors@sptl.co.in • Website: www.sptl.co.in CIN: U45102GJ1997PLC031906

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER 2022

	(Rs. In crore, except per share data and ratios)						
Sr.		Quarte	Ended	Year Ended			
No.	Particulars	30 Sep' 22	30 Sep' 21	31 Mar' 22			
NO.		Unaudited	Unaudited	Audited			
1	Total Income from Operations	1,096.28	970.25	4,035.77			
2	Net Profit before Tax	863.07	897.46	3,250.86			
3	Net Profit after Tax	572.21	474.69	1,957.06			
4	Total Comprehensive Income [Comprising Profit (after tax) and Other Comprehensive Income / (Loss) (after tax)]	479.25	546.77	2,024.29			
5	Paid up Equity Share Capital	2,475.00	275.00	275.00			
6	Reserves (excluding Revaluation Reserve)			18,849.40			
7	Securities Premium Account	17,967.47	20,163.06	20,163.06			
8	Net worth	18,368.25	16,407.68	17,160.59			
9	Paid up Debt Capital / Outstanding Debt	22,516.50	20,532.08	23,417.77			
10	Paid-up 10% Non-Cumulative Redeemable Preference Shares of Rs. 10/- each	-	9.40	-			
11	Paid-up 9% Cumulative Redeemable Preference Shares of Rs. 10/- each	47.00	37.60	47.00			
12	Debt Equity Ratio	1.12	1.12	1.22			
13	Earnings per Equity Share for the period / year of face value of Re. 1/- each :- (refer Note 4)						
	- Basic and Diluted (in Rupees)	0.23	0.19	0.79			
14	Capital Redemption Reserve	-	4.41	4.41			
15	Debenture Redemption Reserve	1,750.00	1,439.50	1,750.00			
16	Debt Service Coverage Ratio	2.90	0.25	0.75			
17	Interest Service Coverage Ratio	2.98	3.01	2.50			

- The above is an extract of the detailed of the original of the Stock Exchange under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results for the quarter ended 30th September 2022 are available on the website of BSE Limited (www.bseindia.com) and can be accessed on the
- Company's website (www.sptl.co.in). For the other line items referred in Regulation 52(4) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to BSE Limited (www.bseindia.com) and can be accessed on the Company's website
- The Audit Committee has reviewed, and the Board of Directors has approved the above results and its release at their respective meetings held on 14th November 2022. The statutory auditors of the Company have carried out a Limited Review of the aforesaid results The Company has issued and allotted 2200,00,00,000 Equity Shares of Re. 1 each as fully paid-up bonus equity shares, by capitalising the reserves, to the existing Equity Shareholders on 26th May 2022. The Earnings Per Share figures for the quarter ended 30th September 2021 and year ended 31st March 2022 have been restated to give effect to the allotment of the bonus shares, as required by INDAS-33.

For Sikka Ports & Terminals Limited Sanjeev Dandekar

Place: Mumbai Date: 14th November 2022 Director DIN: 00022797

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

KONNDOR INDUSTRIES LIMITED

CIN: L51100GJ1983PLC006041

Regd. Off: 201, Avdhesh House, Opp: Devang Park, Opp: Guru Govind Gurudwara, S.G. Highway, Thaltej, Ahmedabd - 380054. Ph; 07940392344

Email: konndorind@gmail.com, Website: www.konndorindustries.com

Quarter ended 30.09.2022 (Unaudited) 448.72	Quarter ended 30.09.2021 (Unaudited) 100.68	Year Ended 31/03/2022 (Audited) 375.17
8.86	20.17	84 47
		UT.T1
8.86	20.17	59.3
6.58	15.14	59.3
0	0	0.18
550.4	550.4	550.4
		276.51
0.12	0.28	1.08
0.12	0.28	1.08
	0 550.4 0.12 0.12 at of Quarterly	0 0 550.4 550.4 0.12 0.28

available on the Stock Exchange websites viz. www.bseindia.com and also on the Company's FOR KONNDOR INDUSTRIES LIMITED

SHASHIKANT THAKAR Date: 12/11/2022 Place: Ahmedabac DIN: 02887471

Samrat Pharmachem Limited Regd Office: Plot No. A2/3445, GIDC, Phase 4. Ankleshwar - 393 002. Gujarat (Website: www.samratpharmachem.com)
Corp Office: 701/702 Business Square, M. A. Road, Andheri (West),
Mumbai - 400 058 (CIN: L24230GJ1992PLC017820) Extract of the Standalone Un-Audited Financial Results for the quarter ended 30 September, 2022

(Rs. In Lakhs except earnings per share)

Quarter Ended Quarter Endes

	Particulars	30-Sep-22 Un-audited	30-Sep-21 Un-audited
1	Income from operations	7,127.68	5,914.87
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	802.04	387.12
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	802.04	387.12
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	591.28	278.95
5	Equity Share Capital	308.97	308.97
6	Earnings per share		
	Basic	19.14	9.03
	Diluted	19.14	9.03

79

(gilifa)

- The above results were reviewed by the Audit Committee of the Board of Directors The Statutory Auditors have carried out a limited review of the results for the guarted ended 30 September, 2022.
- The above unaudited results have been taken on record by the Board of Directors at i Meeting held on Monday, 14 November 2022 at the Corporate Office of the Company. The Company has adopted Indian Accounting Standards ('Ind AS') notified by the Ministry of Corporate Affairs with effect from 01 April 2017 (with a transition date of 01 April 2016) Accordingly the financial results for the quarter ended 30 September 2022 have been prepared in accordance with Companies (Indian Accounting Standard) Rules, 2015 as
- prescribed under section 133 of the Companies Act, 2013.

 The Company manufactures phamaceutical chemicals, which is a single business segment. Figures for the previous period have been regrouped / reclassfied, wherever necessary. For Samrat Pharmachem Limited

Date :14 November 2022

Colour Merchant's Co-operative Bank Ltd. H.O.: Astodia Road, Ahmedabad- 380 001. Phone: 22144708/80

POSSESSION NOTICE

The undersigned being the Authorized Officer of Colour Merchant's Cooperative Bank Ltd. under the Securitization Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the power conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002. issued a demand notice dated 18/05/2022 calling upon the borrower (1) Mr. Chandramuli Jagdishbhai Raval (2) Mr. Pradipbhai Ramanlal Shah (3) Mr. Mukshbhai Ramanlal Yaday to repay the amount mentioned in the notice being Rs. 27.63.794/-(Rupees Twenty Seven Lakh Sixty Three Thousand Seven Hundred Ninety Four only) within 60 days from the date of receipt of the said notice

The borrower having failed to repay the amount notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken the possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said Rule 8 of the said rule on this 8 day of November of the year 2022

The borrower In the particular and the public in general id hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Colour Merchant's Co-operative Bank Ltd.for an amount of Rs. 27,63,794/- and interest thereon. Description of Immovable Property:-

All that piece and parcel of property bearing Flat No.B/F/8 admeasuring 39.15 Sq. Mts. Of Jain Shasannagar Co Op Housing Society Ltd. Bearing old Survey No.298,301and new Survey no.206, T.P.S. No,5 Final Plot No.73,74,75 at Mouje: Jodhpur, Tal: Vejalpur, Dist: Ahmedabad.

Date: 08-11-2022 (Authorized Officer) Colour Merchant's Co-operative Bank Ltd Place: Ahmedabad.

Colour Merchant's Co-operative Bank Ltd. H.O.: Astodia Road, Ahmedabad- 380 001, Phone: 22144708/80 POSSESSION NOTICE

The undersigned being the Authorized Officer of Colour Merchant's Cooperative Bank Ltd. under the Securitization Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the power conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002. issued a demand notice dated 04/05/2022 calling upon the borrower (1) Mr. Samsang Govindbhai Rana (2) Mr. Govindbhai Ambalal Rana (3) Mrs. Jayaben govindbhai Rana (4) Mr. Amitkumar rameshbhai Priyadarshi (5) Rashmikant kanubhai Macwan to repay the amount mentioned in the notice being Rs.06.07.962/-(Rupees Six Lakh Seven Thousand Nine Hander Sixty two only) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken the possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said Rule 8 of the said rule on this 8 day of November of the year 2022

The borrower In the particular and the public in general id hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Colour Merchant's Co-operative Bank Ltd.for an amount of Rs. 06.07.962/- and interest thereon.

All that piece and parcel of property of ${\bf Flat\,No.2}$ on ${\bf Block\,No.3}$ on Ground Floor admeasuring bout 75 Sq, Yds in the land of Marutinandan Co.Op. Housing Society LTD. Situated and lying Sur. No. 106, T.P.S. No.7, Final Plot No.17, Sub plot No.1/1, City Sur. No.3842 (T.P.S. No.7 Khokhara-Mehmdabad), Taluka Maninagar, District Ahmedabad. The Flat known as Marutinadnad Apartment.

Date: 08-11-2022 (Authorized Officer) Colour Merchant's Co-operative Bank Ltd. Place: Ahmedabad.

(₹ Lakhs)

Description of Immovable Property:-

Colour Merchant's Co-operative Bank Ltd. H.O.: Astodia Road, Ahmedabad- 380 001. Phone: 22144708/80 POSSESSION NOTICE

The undersigned being the Authorized Officer of Colour Merchant's Cooperative Bank Ltd. under the Securitization Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the power conferred under section 13 (12) read with Rule 3 of the Security nterest (Enforcement) rules 2002. issued a demand notice dated 18/05/2022 calling upon the borrower (1) Mr. Tushar Jagdishbhai Raval (2) Mrs. Dharmistaben Jagdishbhai Raval (3) Mr. Pradipbhai Ramanlal Shah (4) Mr. Mukshbhai Ramanlal Yadav to repay the amount mentioned in the notice being Rs.29,27,974/-(Rupees Twenty Nine Lakh Twenty Seven Thousand Nine Hundred Seventy Four only) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount notice is hereby given to he borrower and the public in general that the undersigned has taken the possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said Rule 8 of the said rule on this 8 day of November of the year 2022

The borrower In the particular and the public in general id hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Colour Merchant's Co-operative Bank Ltd.for an amount of Rs. 29,27,974/- and interest thereon. Description of Immovable Property:-

All that piece and parcel of property bearing Flat No.B/F/7, admeasuring s 39.15 Sq. Mts. Of Jain Shasannagar situated and lying on the land of JainShasannagar Co.Op. Housing Society Ltd. Bearing old Survey No.298,301 and new Survey no.206, T.P.S. No. 5, Final Plot No.73,74,75, Mouje: Jodhpur, Tal: Vejalpur, Dist: Ahmedabad.

Date: 08-11-2022 (Authorized Officer) Place: Ahmedabad. Colour Merchant's Co-operative Bank Ltd.

Colour Merchant's Co-operative Bank Ltd. H.O.: Astodia Road, Ahmedabad- 380 001. Phone: 22144708/80 **POSSESSION NOTICE**

The undersigned being the Authorized Officer of Colour Merchant's Copperative Bank Ltd. under the Securitization Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the power conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002. issued a demand notice dated 07/05/2022 calling upon the borrower (1) Mr. Kantibhai Motibhai Darii (2) Mr. Bhavesh Natvarlal Darji (3) Mr. Sanketbhai Arvindbhai Thakkar to repay the amount mentioned in the notice being Rs.10,59,440/-(Rupees Ten Lakh Fifty Nine Thousand Four Hundred Forty only) within 60 days rom the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken the possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said Rule 8 of the said rule on this 8 day of November of the year 2022

The borrower In the particular and the public in general id hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Colour Merchant's Co-operative Bank Ltd.for an amount of Rs. 10,59,440/- and interest thereon.

Description of Immovable Property:-Titles deeds and evidences in respect of Lease shold Property bearing Flat sss No.1196 in Block 100(L-100) on the First Floor admeasuring about

26 sq,mts, in the scheme known as "Shreenagar Apartment" of Gujarat Housing Board of 768 LIG SCHEME situated on the land of Final Plot No.368 ,369 & 370 of Town Planning Scheme No.29 (land of old Revenue Survey No.216/20) situate, lying and being at Mouje: Wadaj, Taluka: Sabarmati, Old Taluka: Ahmedabad City(West), in the Registration District of Ahmedabad and Sub District of Ahmedabad-2 (Wadaj). Date: 08-11-2022 (Authorized Officer)

Place: Ahmedabad. Colour Merchant's Co-operative Bank Ltd.

Nanubhai Amin Marg, Industrial Area, P.O. Chemical Industries,

Vadodara - 390 003. Ph.: +91 6353070339 / 6353070343, Fax: +91-265-2281871 Website: http://www.jyoti.com Email: jyotiltd@jyoti.com, CIN:L36990GJ1943PLC000363 EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2022

			Standalo	ne	Consolidated		
Sr.		Quarte	r Ended	Half Year Ended	Quarte	r Ended	Half Year Ended
No.	Particulars -	30-09-2022 (Unaudited)	30-09-2021 (Unaudited)	30-09-2022 (Unaudited)	30-09-2022 (Unaudited)	30-09-2021 (Unaudited)	30-09-2022 (Unaudited)
1	Total Income from operations (Net)	4335	3072	7201	4335	3072	7201
2	Profit /(Loss) Before Interest, Tax, Depreciation & Amortisation (EBITDA)	24	84	68	24	84	68
3	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional Items)	66	274	164	66	274	164
4	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional Items)	17	274	115	26	271	147
5	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional Items)	17	(302)	115	26	(305)	147
6	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	18	(301)	121	27	(304)	153
7	Equity Share Capital	2309	2309	2309	2309	2309	2309
8	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	-	-	-
9	Earning Per Share (of ₹ 10/- each) Basic and diluted	0.07	(1.31)	0.50	0.11	(1.32)	0.64

Notes: (1) The above is an extract of the detailed format of Quarter and Half Year ended 30th September, 2022, of Standalone and Consolidated Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended Financial Results are available on the Company's website a www.jyoti.com and the Stock Exchange's website at www.bseindia.com.

Date: 14-11-2022

Notes.

Place Surat

Date: 14/11/2022

For Jvoti Limited Rahul Nanubhai Amir Chairman & Managing Director DIN: 00167987

SURAT TEXTILE MILLS LIMITED

Rend, Diffice: Tulki Krupa Arcade, 6th Floor, Near Aa; Mata Chowk, Puna-Kumbharia Road Dumbhal Surat 395010 CN: L17119GJ1945PLC000214. Websile: www.suratextiemilisht.com. e-mail: sharedepartment@stmt.in Tet No.(0261) 2311198

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2022 IRs. in Lacs except per share data)

Sr. No.	Particulars	Quarter ended 30.09.2022 (Unaudited)	Half Year ended 30.09.2022 (UNaudited)	Quarter ended 30.09.2021 (Unaudited)
1	Total Income from Operations	1333.38	393.0H	210.18
2	Net Profit /(Loss) for the period (before tax & Exceptional (tems)	186.20	112.23	54.50
3	Net Profit /(Loss) for the period before tax (after Exceptional items)	186.20	112.23	54.50
4	Not Profit /(Less) for the period after tax	1900		
200	(after Exceptional items) Continuin	196.18	82.96	54.50
4	Net Profit /(Loss) for the period after tex	0.000	HISTORY WAS ALVESTED	
	(after Exceptional Items) Discontinuted	0.00	6095.90	(429.61)
5	Total Comprehensive income for the period (Compresing Profit (Itosa) for the period (after tax) and Other Comprehensive Income(after tax))	190.18	6178.88	(375.11)
8	Paid-up Equity Stone Capital (Face Value -Rs. 11- each)	2220.64	2220.64	2220.64
7	Other Equity	200000	Salabragan;	1300
8	Earnings Per Equity Strare (Face Value Rs.16- each). Basic and Diluted (Not Annualised for the quarters and half year).	(0.09)	2.78	(0.17)

The above is an extract of the detailed format of the Unaudited Financial Results for the guarter and half year ended 30th September, 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed financial results and this extract were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 14th November, 2022. The full format of these Financial Results are available on the website of BSE at www.bseindia.com and on Company's website at www.surattextilemillsttd.com.

Previous period's figures have been regrouped / reclassified wherever necessary, to conform to current period's classification.

For and on behalf of Board of Directors For Surat Textile Mills Limited

Alok P. Shah Managing Director DIN: 002181180

JINDAL WORLDWIDE LIMITED

CIN: L17110GJ1986PLC008942

Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol JINDAL Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad – 380015 Phone: 079-71001500 • E-Mail Id: csjindal@jindaltextiles.com • Website : www.jindaltextiles.com

STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) * For the Quarter & Half Year Ended 30th Septemeber, 2022 *

{Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015} (Rs. in Lakhs except EPS) Half Year Ended Year Ended **Quarter Ended** 3 months Preceding Corr. 3 months 6 months ended of C.Y. 3 months ended of P.Y. ended of C.Y. ended of P.Y. Previous Financia ended of P.Y. **Particulars** 30th Sept., 2022 30th June 2022 30th Sept., 2021 30th Sept., 2022 30th Sept., 2021 31st March, 2022 (Un-Audited) (Un-Audited) (Un-Audited) (Un-Audited) (Un-Audited) (Audited) STANDALONE Total income from operations (net) 49947.45 | 66987.42 | 61504.63 | 116934.87 | 113426.00 | 258404.78 9277.38 Net Profit/(Loss) for the period 3814.00 3300.29 5642.00 14453.42 5463.38 (before Tax . Exceptional and/or Extraordinary items) Net Profit/ (Loss) for the period 3814.00 5463.38 3300.29 9277.38 5642.00 14453.42 before tax (after Exceptional and/or Extraordinary items). Net Profit/(Loss) for the period 3050 62 4068.7 2470.76 4233 41 10852.86 after tax (after exceptional and/or Extraordinary items) Total Comprehensive income for 3050.62 4068.77 2470.76 7119.39 4233.41 11757.98 the period after share of profit afte associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] 2005.20 Equity Share Capital 2005.20 2005.20 2005.20 2005.20 2005.20 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March NA NA NA N/ NA 51434.40 2022. Earnings per share (of Rs.1/- each 1.52 2.03 1.23 3.55 2.11 5.86 (for continuing and discontinued operations): 1. Basic 2. Diluted 1.52 2.03 1.23 3.55 2.11 5.86 CONSOLIDATED Total income from operations (net) 47751.53 63050.69 111677.61 115493.23 55915.72 63926.10 Net Profit/(Loss) for the period 4092.55 5583.89 3315.49 9676.44 5832.75 14637.54 before Tax, Exceptional and/o Extraordinary items) Net Profit/ (Loss) for the period 4092.55 5583.89 3315.49 9676.44 5832.75 14637.54 before tax (after Exceptional and/or Extraordinary items)

(for continuing and discontinued operations): 1. Basic 2.08 2. Diluted 1.63 1.25 3.71 5.90 Notes: 1. The above Un-Audited Standalone & Consolidated Financial Statements of the Company for the quarter & half year ended on 30th September, 2022 have been reviewed and recommended by the Audit

Committee and are approved by the Board of Directors at their respective meeting held on 14th November

NA

2.08

2005.20 2005.20

NA

1.63

3272.02

3272.06

4170.35

4170.53

2500.44

2500.57

2005.20

1.25

7442.3

7442.59

2005.20

3.7

4389.76

4390.1

2005.20

2.19

10973.75

11824.88

2005.20

51563.05

5.90

The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 ('Ind-AS') from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in IND-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33

of the SEBI (LODR) Regulations, 2015 (as amended).

3. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Statements of the Company for the quarter & Half Year ended 30th September, 2022 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited

Review Report 4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary

to make them comparable.

5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results fo the guarter & period ended on 30th September, 2022 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results alongwith Standalone & Consolidated Independent Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaltextiles.com). For and On Behalf of the Board For JINDAL WORLDWIDE LIMITED

(Dr. YAMUNADUTT AGRAWAL) DIN: 00243192

Date: 14th November, 2022 Place: Ahmedabad

Net Profit/(Loss) for the period

the period after share of profit after associates and minority interest

[Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)

Reserves (excluding Revaluatior Reserve) as shown in the Audited Balance Sheet as at Previous

Financial Year ended 31st March

Earnings per share (of Rs.1/- each

Equity Share Capital

after tax (after exceptional and/or Extraordinary items) Total Comprehensive income for

Ahmedabad

Is your opinion yours?

Your opinion should belong to you A voice that is your own. Undeterred, Uncompromised, And brave. A conscience that isn't at peace, until the truth is uncovered A mind that isn't fuelled by someone else's thoughts. Where actions are based on informed opinion and not ignorant assumptions.

Because it's not about going where everyone goes Or being part of a trend because it is one. Or taking sides because you don't know enough.

The freedom to have an opinion that's yours

At Indian Express, we stand by this freedom. We celebrate it by being unbiased and independent And by having a voice that isn't afraid to speak its mind.

#InformYourOpinion

The Indian Express. For the Indian Intelligent



indianexpress.com

♦ The Indian EXPRESS

ARYAVAN ENTERPRISE LIMITED

CIN: L52100GJ1993PLC018943 Address: 308 Shital Varsha Arcade, Onn. Girish Cold Drinks, C. G. Road, Navranggura, Ahmedahad - 380,009 tatement of Unaudited financial results for the Quarter and Half Year ended 30/09/2023

(Rs. In Lakhs except EPS) Quarter Year to Correspondir Ending on Date Figures Three Months 30.09.2022 31.03.2022 Ended in the **Particulars** Previous Yea 31.09.2021 1 Total income from operations (net) 0.00 27.16 0.43 2 Net Profit for the period (before Tax, -11.44 -0.240.00 Exceptional and/or Extraordinary items 3 Net Profit for the period before Tax, (after -0.24 0.00 -11.38 Exceptional and/or Extraordinary items) -0.29 0.00 4 Net Profit for the period after tax (after -11.38 Exceptional and/or Extraordinary items) 5 Total Comprehensive income for the -11.38 -0.290.00

8 Earnings Per Share (Basic / Diluted)

period (after Tax)

6 Equity Share Capital

7 Face Value of Equity Share Capital

The above is an extract of the detailed format of Quarterly and half yearly as on 30th September, 2022 Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com.

For, Aryavan Enterprise Limited SD/-Jitendrasingh H. Rathod Director

Date: 14-11-2022 Place: Ahmedabad

DIN: 02454172

385.04

-0.30

385.04

-0.08

385.04

10

0.00

ફ્રેઝ થ્રી લીમીટેડ

CIN: L99999DN1985PLC000197 રજી.ઓફીસ : સર્વેં૩૮૦/૧, ખાનવેલ સિલવાસા રોડ, દપાડા, સિલવાસા - ૩૯૬ ૨૩૦ યુટી ઓફ કી એન્ક એન.એચ. / ટેલી : ૯૧ (૨૨) ૪૩૫૧૪૪૪૪ E-mail:cs@fazethree.com| Website:www.fazethree.com

પોસ્ટલ બેલેટ નોટીસ અને ઈ-વોર્ટીંગ માહિતી

આથી સચના આપવામાં આવે છે કે, ફેઝ થી લીમીટેડ ('કંપની')નીચેના ઠરાવો પર રીમોટ ઈ વોર્ટીંગ પ્રક્રિયા દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા કંપનીના સભ્યોની મંજુરી માંગી રહી છે

ક્રમ નં.	કરાવોનું વર્ણન	ઠરાવોનો પ્રકાર
1	કંપનીના બિન-કાર્ચકારી સ્વતંત્ર ડીરેક્ટર તરીકે શ્રી જેમ્સ બેરી લીચોનાર્ડ (ડીઆઈએન.: ૦૯૭૪૪૮૦૩) ની નિમણુંક	NIS9 RIM
2	કંપનીના બિન-કાર્ચકારી સ્વતંત્ર ડીરેક્ટર તરીકે શ્રી ચુજી કોન્ડો (ડીઆઇએન.: ૦૯૭૪૪૭૬૦) ની નિમણૂંક	ખાસ કરાવ
3	નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સામગ્રી સબંધીત પક્ષના વ્યવહારો ની મંજુરી	સામાન્ય કરાવ
¥	નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૪ માટે સામગ્રી સબંધીત પક્ષના વ્યવકારો ની મંજરી	સામાન્ય ઠરાવ

આ પોસ્ટલ બેલેટ 🖃 ટીસ એવા સભ્યોને ઇલેક્ટ્રોનીક રીતે મોકલવામાં આવી છે કે જેમનું ઈ-મેઈલ સરનામું કંપની / કીપોઝીટરી સહભાગીઓ / કંપનીના રજીસ્ટાર અને શેર ટાન્સકર એજન્ટ સાથે નોંધાચેલ છે લીંક ઈનટાઈમ પ્રાઈવેટ લીમીટેક ('લીંક ઈનટાઈમ') શુક્રવાર નવેમ્બર ૧૧. ૨૦૨૨ એટલે કે કટ-ઓક તારીખ કંપનીએ સોમવાર, ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ પોસ્ટલ બેલેટ નોટીસની ઈલેક્ટ્રોનીક ડીસ્પેચ પૂર્ણ કરી છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય ભારત સરકાર હ્મારા જારી કરવામાં આવેલા સામાન્ય પરિપત્ર નંબર o3 / ૨૦૨૨ ના પાલનમાં, અન્ય સબંધીત પરિપત્રો પોસ્ટલ બેલેટ નોટીસ અને પોસ્ટલ બેલેટ કોર્મ ની ભૌતિક નકલ અને પ્રિ-પેઇક વ્યવસાચીક જવાબ સાથે વાંચો આ પોસ્ટલ બેલેટ માટે સભ્યોને કવર મોકલવામાં આવતું નથી સભ્યોની સંમતિ અથવા અસંમતિનો સંચાર માત્ર દુરસ્થ ઈ-વોર્ટીંગ સિસ્ટમ દ્વારા જ થશે.

પોસ્ટલ બેલેટ નોટીસ કંપનીની વેબસાઈટ https://www.fazethree.com અને બી.એસ.ઈ. લીમીટેડની વેબસાઈટ www.bseindia.com પર અને નેશનલ સીક્યોરીટીટ કીપોઝીટરી લીમીટેક (એન.એસ.કી.એલ.) ની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે જે સભ્યોને પોસ્ટલ બેલેટ નોટીસ મળી નથી તેઓ ઉપરોક્ત વેબ એડ્રેસ પરથી તેને ડાઉનલોડ કરી શકે છે.

રીમોટ ઈ-વોર્ટીંગ માટેની સ્ચનાઓ

કંપનીએ રીમોટ ઈ-વોર્ટીંગ સુવિધા પુરી પાડવા એજન્સી તરીકે એન.એસ.ડી.એલ. ની સેવાઓ રોકી છે. રીમોટ ઈ-વોર્ટીંગ દ્વારા મત આપવા માટેની વિગતવાર પ્રક્રિયા પોસ્ટલ બેલેટ નોટીસર્ન નોંધોમાં આપવામાં આવી છે કટ-ઓફ તારીખે સભ્યોના નામે નોંધાયેલ ઇકિવટી શેરના પેઈડ-અપ મૂલ્ય પર મતદાનના અધિકારોની ગણતરી કરવામાં આવશે. કટ-ઓફ તારીખે સભ્ય ન હોય તેવી કોઈપણ વ્યક્તિ આ સુચનાને માત્ર માહિતીના હેતુ માટે જ ગણશે.

નીચે દરાવિલ સમયગાળા દરમ્યાન સભ્યો રીમોટ ઈ-વોર્ટીંગ દ્વારા તેમનો મત આપી શકે છે :

રીમોટ ઈ-વોર્ટીંગની શરૂઆત	मंत्रणपार, १५ जपेभ्जर, २०२२ ना शेष सपारे ०६.०० पाग्चे (MIRAीय समय)			
રીમોટ ઈ-વોર્ટીંગની અંત	બુધવાર, ૧૪ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ સાંજે ૯૫.૦૦ વાગ્યે (ભારતીય સમય)			

ઉપરોક્ત તારીખ અને સમય પછી ઈ-વોર્ટીંગની મંજુરી આપવામાં આવશે નહીં ત્યારબાદ ઉપરોક્ત સમયગાળાની સમાપ્તિ પર એન.એસ.ડી.એલ. દ્વારા ઈ-વોર્ટીંગ મોડ્યુલને તરતજ અક્ષમ કરવામાં આવશે.

ઈ-મેઈલ સરનામું નોંધણી / અપકેટ કરવની રીત :

એ) ડીમટીરીયલાઈઝ્ડ મોડ માં શેર ધરાવતા સભ્યો તેમના સબંધીત ડિપોઝીટરી સહભાગીઓ સાથે તેમના ઈ-મેઈલ એડ્રેસની નોંધણી / અપકેટ કરી શકે છે કે જેમની સાથે તેઓ તેમના કીમેટ ખાતા (ઓ) જાળવી રાખે છે.

બી) જે સભ્યો ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવે છે અને જેમણે તેમના ઈ-મેઈલ એડ્રેસની નોંધણી કરાવી નથી તેઓ તેની વેબસાઇટ https://linkintime.co.in /emailreg/email_register.html પર લીંક ઈન-ટાઈમ સાથે અસ્થાયી રૂપે નોંધાગી /અપડેટ કરી શકે છે.

ઠરાવો જો મંજુર કરવામાં આવે તો રીમોટ ઈ-વોર્ટીંગના છેલ્લા દિવસે એટલે કે બુધવાર, ડીસેમ્બર ૧૪, ૨૦૨૨ ના પસાર થયા हોવાનું માનવામાં આવશે. વોર્ટીંગના પરિણામો કંપની દ્વારા શુક્રવાર, ૧૬ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ અથવા તે પફેલા જાહેર કરવામાં આવશે, કંપનીની વેબસાઈટ https://www.fazethree.com અને બી.એસ.ઈ. લીમીટિક અને www.bseindia.com પર સંચાર કરવામાં આવશે અને એન.એસ.ડી.એલ.ની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ રહેશે. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં તમે www.evoting.nsdl.com ના કાઉનલોક વિભાગ પર ઉપલબ્ધ શેર ધારકો માટે ("FAQs") અને શેર ધારકો માટે ઈ-વોર્ટીંગ વપરાશ કરતા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા એન.એસ.ડી.એલ (સરનામું ટાઈમ્સ ટાવર કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતી બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ ૪૦૦૦૧૩) ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ /૧૮૦૦ ૨૨૪ ૪૩૦ પર અથવા બોર્ડના આદેશથી evoting@nsdl.co.in. પર વિનંતી મોકલો. ક્રેઝ શ્રી લીમીટેક વર્ત

તારીખ : નવેમ્બર ૧૪,૨૦૨૨ સ્થળ : મુંબઈ

શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ: ૮૦૨ નરનારાયણ કોમ્પ્લેક્સ,નવરંગપુરા પોસ્ટ ઓફિસ પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯, ગુજરાત દેલિક્ષેન નં.: ૦૭૯-૨૬૫૬૫૭૯૨ ઈ-મેલ: admin@jagdambapolymers.com વેબસાઈટ: www.shrijagdamba.com

સપ્ટે	મ્બર ૩૦, ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર	માટે અનઓડિ	ટેડ નાણાકીય	પરિણામોનો અર્ક
				ાય લાખોમાં રૂ.)
		ત્રિમાસિક	પાછલા	પાછલા વર્ષ
ક્રમ	વિગત	ગાળાના	વર્ષના અંતે	
નં.	(40)((30.06.22	39.03.22	અનુરૂપ ત્રણ મહિના પૂરા થયા
1	કામગીરીમાંથી કુલ આવક (નેટ)	૧૦૦૭૨.૧૭	3८० ६२.८५	6003.22
2	સમયગાળા માટે યોખ્ખો નફ્રો (કર પહેલાં, અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ)	૯૯૧.૫૦	६७३७.२४	૧૮૦૦.૭૨
3	કર પહેલાંના સમયગાળા માટે યોખ્ખો નફો, (અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	૯૯૧.૫૦	₹ 030.2 ४	૧૮૦૦.૭૨
4	કર પછીના સમયગાળા માટે યોખ્ખો નફ્રે (અસાધારણ અને/અથવા અસાધારણ વસ્તુઓ પછી)	૭૦૫.૦૧	ય૧૧૬.૦૪	૧૪૪ ૭.૯૦
5	સમયગાળા માટે કુલ વ્યાપક આવક (કર પછી) અને અન્ય વ્યાપક આવક (કર પછી)	-	ય૧૧૮.૯૨	-
6	ઇક્વિટી શેર ક્રેપિટલ	૮૭.૫૮	૮૭.૫૮	૮૭.૫૮
7	પાછલા વર્ષની બેલેન્સ શીટમાં બતાવ્યા પ્રમાણે અનામત (પુનઃમૂલ્યાંકન અનામત સિવાય)	_	૧૮૨૭૪.૩૮	-
8	ઇક્વિટી શેર મૂડીનું ફેસ વેલ્યુ	٩	٩	٩
9	શેર દીઠ કમાણી (અસાધારણ વસ્તુઓ પહેલાં અને પછી) મૂળભૂત / પાતળું:	૮.૦૫	૫૮.૪૫	૧૬.૫૩

ઉપરોક્ત SEBI (લિસ્ટિંગ અને અન્ય ડિસ્ક્લોઝર જરૂરીયાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન 33 ફેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરાયેલ ત્રિમાસિક નાણાકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો એક અર્ક છે. ત્રિમાસિક નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે www.bseindia.com અને કેંપનીની વેબસાઇટ www.shrijagdamba.com. પર ઉપલબ્ધ છે.

શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ માટે.

રમાકાંત ભોજનગરવાલા

તારીખ: ૧૪.૧૧.૨૦૨૨ સ્થળ: અમદાવાદ

(ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર) (ડીઆઈએન: 00012733) ઓસ્ટિન એન્જિનિચરિંગ કંપની લિમિટેડ

ઇ-વૉટિંગની શરૂઆત ઇ-વૉટિંગની સમાપ્તિ

ફેક્સ : ૦૨૭૩ ૨૫૨૨૨૫.

ફક્સ : ૦૨૭૩ ૨૫૨૨૨૫. ઇ-મેલ : info@aec.com વેબસાઇટ : www.aec.com CIN No. : L27259GJ1978PLC003179 પોસ્ટલ બેલટની નોટિસ

રિજસ્ટર્ડ ઑફિસ : ગામ : પાટલા, તાલુકો : ભેસાણ, જિલ્લો જૂનાગઢ-રૂક્સ૦૩૦ (ગુજરાત ઇન્ડિયા) ફોન : + ૦૨૮૭૩, ૨૫૨૨૬૭/૬૮,

બુધવાર, નવેમ્બર ૧૬, ૨૦૨૨ સવારે ૦.૯.૦૦ વાગ્યાથી ગુરૂવાર, ક્રિસેમ્બર ૧૫, ૨૦૨૨ સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી બેલેટની નોટિસમાં નક્કી કરાચેલા કરાવો અનુસાર અને કંપની કાયદો ૨૦૧૩ (''કાયદો'')ની કલમ ૧૦૮ અને ૧૧૦ને કંપનીઝ(મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ (''નિયમો'')ના નિયમો ૨૦ અને ૨૨ તથા સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (લિસ્ટીંગ અને જવાબદારીઓ અને ઘટસ્ફોટ જરૂરિયાત) નિયમ ૨૦૧૫ ('લિસ્ટીંગ રેગ્યુલેશન્સ')ના રેગ્યુલેશન્સ ૪૪, સામાન્ય સભા માટેના સચિવીય ધોરણ-ર (એસ.એસ.-ર)લાગુ પડતી જોગવાઈઓ અને નિયમોની લાગુ પડતી અન્ય જોગવાઈઓ . અન્વચે તથા કોર્પોરેટ બાબતોના મંત્રાલચ દ્વારા જારી કરાચેલ પરિપત્રો લાગુ પડતા અન્ય કાયદા અને નિયમનો અનુસાર કંપની તેના સભ્યો પાસેથી પોસ્ટલ બેલેટ નોટિસ તારીખ રર-૧૦-૨૦૨૨માં જણાવ્યા પ્રમાણેના રિઝોલ્યુશનની સભ્યશ્રીઓની સંમતિ માંગે છે.

એમસીએ પરિપત્રો અને સેબીના પરિપત્રો અનુસાર જે સભ્યોના નામ કંપનીના રજિસ્ટરમાં શુક્રવાર તા. ૧૧-૧૧-૨૦૨૨ (કટ-ઑફ-ડેટ)ના રોજ કામકાજ બંધ થવાના સમયે નોંધાયેલા હોંચ અને જેઓના ઇ-મેલ એડ્રેસ કંપની અથવા કિપોઝિટરીસ/કિપોઝિટરી પાર્ટિસિપન્ટસ પાસે નોંધાયેલ છે. તેઓને માત્ર ઇલેક્ટ્રોનિક મોડ મારફત સોમવાર તા. ૧૪-૧૧-૨૦૨૨ના રોજ નોટિસ મોકલવાની કામગીરી પૂરી કરાચેલ છે.

જે સભ્યશ્રીઓના ઇ-મેલ સરનામાં કંપની અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ પાસે કટ-ઓફ-કેટના રોજ નોંધાયેલા નથી તેઓને તેમના કિપોઝિટરી પાસેના ઇલેકટ્રોનિક હોલ્કીંગ અન્વયે તેઓના ઇ-મેલ સરનામા લાગતા વળગતા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ પાસે નોંધાવવા.

કંપનીએ સેબી લિસ્ટીંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન ૪૪ અનુસાર, કંપનીના સભ્યોને ઇલેક્ટ્રોનિક સગવડતા પૂરી પાડવા માટે કંપની સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેંડ (સી.ડી.એસ.એલ.) ની સેવાઓ રોકેલ છે.

રીમોટ ઇ-વોર્ટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા/સૂચનો પોસ્ટલ બેલટની નોટિસમાં જણાવેલ છે. આથી આ બાબતમાં સભ્યશ્રીઓને સૂચિત કરવામાં આવે છે કે :

૧. સભ્યશ્રીઓ તેમના મત માત્ર ઈ-વોર્ટિંગ મારફત ઠરાવો પર બુધવાર, નવેમ્બર ૧૬, ૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ વાગ્યાથી શરૂ કરીને ગુરૂવાર, કિસેમ્બર ૧૫, ૨૦૨૨ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી આપી શકશે.

ર. જે સભ્યશ્રીઓ પોતાનો મત ઇ-વોર્ટિંગ પ્રક્રિયા દ્વારા આપવા માંગતા હોય તેને પોસ્ટલ બેલટની નોદિસમાના સૂચનો વાંચી જવા અને નોદિસના વોટ આપવાના નોદ્ય વિભાગમાં દર્શાવેલ ઇ- વોદિગણી વોટ આપવા માટેની પ્રક્રિયા અનુસરીને તેમની સંમતિ માટે (ફોર) અને અસંમતિ માટે (અગેઇન્સ્ટ) ગુરવાર, ડિસેમ્બર ૧૫, ૨૦૨૨ સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં નોંધવું. સી.ડી.એસ.એલ. દ્વારા ત્યાર બાદ તુરત જ ઇ-વોર્ટિંગ સવલત અક્ષમ કરાશે.

3. રીમોટ ઇ-વોર્ટિંગ મારફત મૃત આપવા માટેની લાયકાતની કટ-ઑફ-કેટ શુક્રવાર, નવેમ્બર ૧૧. ૨૦૨૨ નક્કી કરવામાં આવેલ છે. જે વ્યક્તિ કટ-ઑક-ડેટના રોજ સભ્ય ન હોય તેઓએ આ નોટિસ માત્ર જાણ માટેના હેતુસરની જ ગણવી. ૪. જે સભ્યોના શેર ડિમટેરીયલાઇઝડ મોડમાં હોય તેઓ ઇલેક્ટ્રોનિક માધ્યમ મારફત

જ એટલે કે રીમોટ ઇ-વોર્ટિંગમાં તેઓ મત આપી શકશે.

પ. એમસીએ પરિપત્રો હેઠળ નિશ્ચિત જરૂરિયાતોને અનુલક્ષીને સભ્યોને પોસ્ટલ બેલેટ ક્ષેર્મ સાથે નોટિસની હાર્ડ કોપિ અને પ્રિ-પેઇડ પોસ્ટેજ માટેનું સેલ્ફ-એડ્રેસ્ડ વ્યવસાચિક જવાબી પરબીડીયું મોકલાશે નહીં. . પોસ્ટલ બેલટની નોટિસ ન મળવાના કિસ્સામાં કટ-ઓફ-ડેટના રોજ સભ્ય ન હોય

તેઓ કંપનીની વેબસાઇટ <u>www.aec.com</u> અથવા સીડીએસએલની વેબસાઇટ <u>www.evotingindia.com</u> ઉપરથી ડાઉનલોડ કરી શકશે. ૭. મે. કે. જે. શાહ એન્ડ કંપનીના શ્રી કૌશીક જયંતીલાલ શાહ, કંપની સેક્રેટરી-અમદાવાદની નિમણુક પોસ્ટલ બેલટ પ્રક્રિયા ન્યાયી અને પારદર્શક રીતે સંચાલન કરવા માટેસ્કૃટિનાઇઝર તરીકે કરવામાં આવી છે.

૮. પોસ્ટલ બેલટના પરિણામ ચેરમેન અથવા કંપનીના ચેરમેન દ્વારા અધિકૃત કરાચેલ વ્યક્તિ દ્વારા શનિવાર, ડિસેમ્બર ૧૭, ૨૦૨૨ના રોજ કંપનીની રજિસ્ટર ઓફિસે જાહેર

૯. રીપોર્ટ સાથેના પરિણામ કંપનીની વેબસાઇટ WWW.aec.com પર મુકાશે, તેમજ બીએસસી અને સીડીએસએલ ને પણ જાણ કરાશે.

૧૦.ઇ-વોર્ટિંગને લગતા કોઇ પણ પ્રશ્નો અથવા મુદાઓ બાબતે શ્રી રાકેશ દાલવી, મેનેજર (સી.ડી.એસ.એલ.)સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિ.,એવિંગ, રપ મો માળ, મેરેથોન ક્યચરેક્સ, મકતલાલ મિલ કમ્પાઉન્ડ, એન એમ જોષી માર્ગ, લોઅર પરેલ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૩ ને લખવું અથવા

helpdesk.evoting@cdslindia.com ઉપર ઇ-મેલ કરવો અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર કોલ કરવો. પોસ્ટલ બેલટના પ્રશ્નો માટે શ્રી કિરણ શાહ. એક્ઝિક્યુટિવ ઑફિસર (સેક્રેટરિયલ)kiranshah09@yahoo.com ને ઇ-મેલ કરવો ઇ-વોર્ટિંગને લગતા કોઇ પણ પ્રશ્નો બાબતે <u>www.evotingindia.com</u> ઉપર પ્રાપ્ય ઇ-વોર્ટિંગ મેન્યુઅલના હેલ્પ વિભાગ અને (FAQ) જોઇ જવા અથવા helpdesk.evoting@cdslindia.com ઉપર ઇમેલ કરવો.

સભ્યશ્રીઓએ ઇ-વોર્ટિંગ દ્વારા મત આપવાની પદ્ધતિ અને નોટિસમાંની તમામ નોંધ દયાનથી વાંચી લેવી.

બૉર્ડ ઑફ ડાયરેક્ટર્સના આદેશ અનુસાર ઓસ્ટિન એન્જિનિયરિંગ કંપની લિમિટેડ વૃતી

CIN: L18109GJ2010PLC062928

Gujarat, India • Tel No: -+91-079-25731155 • Website:www.upgl.in • Email-info@unitedpolyfab.com Extract Of Unaudited Financial Results For The Quarter And Half Year Ended On September 30, 2022

Quarter Ended

Unaudited Unaudited Unaudited

17,017.92

197.91

197.91

182.65

182.65

2,095.16

0.87

14,806.66

156.76

156.76

80.59

80.59

0.38

0.38

1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the guarter and half ended on September

2. These Standalone Unaudited Financial Results have been reviewed by the Audit Committee in its meeting held on

November 14, 2022 and were approved by the board of directors in their meeting held on November 14, 2022.

30, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Reguirements

Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the guarter and half ended on September 30. 2022, is available on the website of Stock Exchange at www.nseindia.com as well as on the Company's Website at

30-09-2022 30-06-2022 30-09-2021 30-09-2022 30-09-2021 31-03-2022

18,052.04

594.53

594.53

492.65

492.65

2,095.16

2.35

Unaudited

31,824.58

354.66

354.66

263.24

263 24

2,095.16

1.26

For, UNITED POLYFAB GUJARAT LIMITED

GAGAN NIRMALKUMAR MITTAL

CHAIRMAN & MANAGING DIRECTOR

DIN: 00593377

સ્થળ : પાટલા, ડિસ્ટ્રિક્ટ : જૂનાગઢ. આર. આર. બાંભણીયા (મેનેજિંગ ડિરેક્ટર) ડીન નંબર: ૦૦૧૪૬૨૧૧ તારીખ : ૧૫-૧૧-૨૦૧ેર

S ASSAM POWER DISTRIBUTION COMPANY LIMITED

NOTICE INVITING TENDER

Power Distribution Company Limited (APDCL) invites online its for "Appointment of Advanced Metering Infrastructure (AMI) Provider for Smart Prepaid Metering in APDCL on DBFOOT, Build, Finance, Own, Operate, Transfer) basis under Revamped tion Sector Scheme" against the following tender:

1. APDCL/CGM(PP&D)/RDSS/Smart Metering/2022/PKG-7/14 Dated: 15-11-2022 The RfP documents can be downloaded for free from our official website www.apdcl.org and also from Govt. of Assam's e-procurement portal https://assamtenders.gov.in. : 15-11-2022

Date of publication of RfP Notice Date of commencement of download of RfP Date of pre-bidding meeting : 18-11-2022 0930 Hours : 25-11-2022 1200 Hours Commencement of e-bidding 14-12-2022 0930 Hours Last date for e-bidding 28-12-2022 1600 Hours Date of opening of technical bid : 29-12-2022 1600 Hours The other details can be seen in the RfP document.

Sd/- Chief General Manager (PP&D), APDCL Please pay your energy bill on time and help us to serve you better!

FAZE THREE AUTOFAB LIMITED

(CIN: L17120DN1997PLC000196) Regd. Office: Plot No. 445, Waghdhara Village Road, Village Dadra, Dadra, UT of Dadra and Nagar Haveli and Daman and Diu - 396 193

Website: www.fazethreeautofab.com | Tel: 022 4351 4400 પોસ્ટલ બેલેટ નોટીસ અને ઈ-વોર્ટીંગ માફિતી

કેઝ થી ઓટોફેબ લીમીટિક ('કંપની')ના સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે કંપની એક્ટ, ૨૦૧૩ ("અધિનીયમ") ની કલમ ૧૧૦ અને અન્ય લાગુ જોગવાઈઓ, જો કોઇ હોય તો, નિયમો ૨૦, ૨૨ સાથે વાંચો. કંપનીઓ (વ્યવસ્થાપન અને વહિવટ) નિયમો, ૨૦૧૪ સામાન્ય પરિપત્ર ને ૧૪/૨૦૨૦ તા. ૮.૪.૨૦૨૦, ૧૭/૨૦૨૦ તા. 43.8.2020, 20/2020 dl. 4.4.2020, 22/2020 dl. 14.5.2020, 33/2020 dl. 22.6.2020, 36/2020 dl. 31.12.2020, 10/2021 dl. **૨૩.૬.૨૦૨૧, ૨૦/૨૦૨૧ તા. ૮.૧૨.૨૦૨૧ અને ૩/૨૦૨૦ તા. પ.પ.૨૦૨૨** ('એમ.સી.એ. પરિપત્રો ') ઈન્સ્ટીટચુટ ઓફ કંપની સેકેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ જનરલ મીટીંગ્સ પર સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ ("એસ.એસ.-૨'') અને કોઈપણ અન્ય લાગુ કાયદા, નિયમો અને વિનિયમો (કોઈપણ વૈદ્યાનિક ફેરફાર (કો) અથવા પ્નઃ અધિનિયમ (ઓ સહિત)) તેના માટે, હાલમાં અમલમાં છે. કંપની સામન્ય ઠરાવો દ્વારા નાસ વ્યવસાયો માટે સભ્યોની મંજુરી માંગે છે. (એટલે કે રીમોટ ઈ-વોર્ટીંગ) માત્ર

પોસ્ટલ બેલેટ નોટીસની ઇલેક્ટ્રોનીક નકલો સોમવાર , ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ એવા સભ્યોને મોકલવામાં આવી છે કે જેમના ઈ-મેઈલ સરનામા કંપની/ડીપોઝીટરી સહભાગીઓ/કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટમાં નોંધાયેલા છે લીંક ઈન ટાઈમ પ્રાઈવેટ લીમીટેડ ('લીંક ઈન ટાઈમ') શુક્રવાર, નવેમ્બર ૧૧, ૨૦૨૨ એટલે કે sz-ઓફ તારીખ પોસ્ટલ બેલેટ નોટીસની ભૌતિક નકલો, પોસ્ટલ બેલેટ ફોર્મ્સ અને પ્રિ-પેઈડ બિઝનેસ એપ્લાય એન્વલપ્સ સાથે આ પોસ્ટલ બેલેટ માટે સભ્યોને એમ.સી.એ. પરિપત્રોમાં આપવામાં આવેલી મુકિત ને અનુરૂપ મોકલવામાં આવી રહી નથી.

આ પોસ્ટલ બેલેટ નોટીસ કંપનીની બેવસાઇટ www.fazethreeautofab.com પર અને સ્ટોક એક્ષચેન્જની વેબસાઇટ એટલે કે બીએસઈ લીમીટિક (''બીએસઈ'' www.bseindia.com પર અને નેશનલ સિક્યોરીટીઝ ડીપોઝીટરી લીમીટેડન વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે (એનએસડીએલ) www.evoting.nsdl.com પર જે સભ્યોને પોસ્ટલ બેલેટ નોટીસ મળી નથી તેઓ ઉપર જણાવેલ વેબ એડ્રેસ પરથી ડાઉનલોડ કરી શકે છે.

ઈ-મેઈલ સરનામું નોંઘણી / અપકેટ કરવની રીત :

એ) ડીમટીરીયલાઈઝ્ડ મોડ માં શેર ધરાવતા સભ્યો તેમના સબંધીત ડિપોઝીટરી સહભાગીઓ સાથે તેમના ઈ-મેઈલ એડ્રેસની નોંધણી / અપડેટ કરી શકે છે કે જેમની સાથે તેઓ તેમના કીમેટ ખાતા (ઓ) જાળવી રાખે છે.

બી) જે સભ્યો ભૌતિક સ્વરૂપમાં શેર ઘરાવે છે અને જેમણે તેમના ઈ-મેઈલ એડ્રેસની નોંધણી કરાવી નથી તેઓ તેની વેબસાઈટ https://linkintime.co.in /emailreg/email_register.html પર લીંક ઈન-ટાઈમ સાથે અસ્થાયી રૂપે નોંઘણી /અપકેટ કરી શકે છે.

કંપનીઝ નેશનલ સીક્યોરીટીઝ કિપોઝીટરી લીમીટેક (એન.એસ.કી.એલ) દ્વારા પુરી પાકવામાં આવતી ઈ-વોર્ટીંગ સેવાઓ દ્વારા ઈલેકટ્રોનિક માધ્યમથી તેમના મત આપવાન અધિકારનો ઉપયોગ કરવાની સુવિધા પુરી પાડે છે. નોટીસમાં ઈ - વોર્ટીંગ માટેની વિગતવાર સુચનાઓ આપવામાં આવી છે.

રીમોટ ઈ-વોર્ટીંગ સુવિધા નીચેના સમયગાળા દરમ્યાન ઉપલબ્ધ છે :

ટીમોટ ઈ-વોર્ટીગની શરૂઆત મંગળવાર, ૧૫ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્યે (ભારતીય સમય) રીમોટ ઈ-વોર્ટીંગની અંત બુધવાર, ૧૪ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યે (ભારતીય સમય)

આ સમયગાળા દરમિયાન, કટ-ઓક તારીખે ભૌતિક સ્વરૂપમાં આથવા ડીમટીરીયલાઈઝ્ડ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો ઈ-વોર્ટીંગ દ્વારા તેમનો મત આપી શકે છે. એક વાર સભ્ય દ્ભારા **ઠરાવ પર મત આપવામાં આવે તે પછીથી તે**ને બદલવાની મંજુરી નથી સભ્યોન મતદાન અધિકારો કટ-ઓફ તારીખે કંપનીની પેઈંડ -અપ ઈક્વિટી શેર મૂડી ના તેમના િફસ્સાના પ્રમાણમાં हોવા જોઈએ જે વ્યક્તિ કટ-ઓફ તારીખે સભ્ય નથી તેણે અ સુચનાને ફક્ત માહિતીના હેતુ માટે જ ગણવી જોઈએ.

નિયામક મંડળે મેસર્સ એ. ડી. પારેખ એન્ડ એસોસીએટ્સ, પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરી (સદસ્થતા નંબર ૩૧૯૯૦,સી.પી.નં. ૨૪૨૬૭) પોસ્ટલ બેલેટ પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવા માટે તપાસકર્તા તરીકે.

સ્કટીનાઈઝરે મતદાનનો સમયગાળો પરો થયા પછી તેનો અહેવાલ કંપનીના અધ્યક્ષ અથવા કંપનીના અન્ય કોઈપણ અધિકૃત અધિકારી (ઓ) ને સુપ્રરત કરશે અને પોસ્ટલ બેલેટના પરિણામો શુકવાર, ૧૬ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ અથવા તે પહેલા જાહેર કરવામાં આવશે બી.એસ.ઈ. લીર્મીટેડ (''બીએસઈ") સ્ટોક એક્ષચેન્જને તેની જાણ કરીને જ્યાં કંપનીના શેર સુચીબધ્ધ છે. વધુમાં પરિણામો કંપનીની વેબસાઈટ www.fazethreeautofab.com અને એન.એસ.ડી.એલ ની વેબસાઇટ www.evoting.nsdl.com પર જાહેર કરવામાં આવશે.

કોઈપણ પ્રક્ષોના કિસ્સામાં તમે www.evoting.nsdl.com ના કાઉનલોક વિભાગ પર ઉપલબ્ધ શેર ધારકો માટે ("FAQS") અને શેર ધારકો માટે ઈ-વોર્ટીંગ વપરાશ કરતા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા એન.એસ.ડી.એલ (સરનામું ટાઈમ્સ ટાવર કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતી બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ ૪૦૦૦૧૩) ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ /૧૮૦૦ ૨૨૪ ૪૩૦ પર અથવ evoting@nsdl.co.in. પર વિનંતી મોકલો.

બોર્ડના આદેશથી ફેઝ થ્રી ઓટોફેબ લીમીટેક વૃતી

તારીખ: નવેમ્બર ૧૪, ૨૦૨૨

(Rs. in Lakhs Except EPS)

Unaudited

30,799.46

739.33

739.33

647.56

647.56

2,095.16

3.09

For the Year Ended

Audited

2,105.41

1,215.22

1,215.22

940.46

940.46

2,095.16

3.416.08

4.49

4.49

રોશન ગુપ્તા કંપની સેકેટરી

શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ

CIN: L17239GJ1985PLC007829

રિજિસ્ટર્ડ એક્રિસ: ૮૦૨, નરનારાયણ કોમ્પ્લેક્સ, નવરંગપુરા પોસ્ટ એફ્રિસ પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯, ગુજરાત **ટેલિફ્રીન નં.**: ૦૭૯-૨૬૫૬૫૭૯૨ **ઈ-મેલ:** admin@jagdambapolymers.com **વેબસાઈટ:** www.shrijagdamba.com

નોટિસ

આથી તમામ શેરધારકો, હિતધારકો અને તમામ સંબંધિત વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સોમવાર, નવેમ્બર ૧૪, ૨૦૨૨ના રોજ યોજાયેલી તેમની બોર્ડ મીટિંગમાં કંપનીની નોંધાયેલ ઓફિસમાંથી સ્થળાંતર કરવા માટેનો ઠરાવ પસાર કર્યો છે. પહેલા– ૮૦૨, નરનારાયણ કોમ્પ્લેક્સ, નવરંગપુરા પોસ્ટ ઓફિસપાસે, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯, ગુજરાત હવે- હાર્મની, ૪થો માળો, ૧૫/એ, શ્રી વિદ્યાનગર કો. ઓપ. હાઉસિંગ સો. લિ., નાબાર્ડની સામે, ઉસ્માનપુરા ગાર્ડન પાસે, ઉસ્માનપુરા, અમદાવાદ – ૩૮૦૦૧૪, ગુજરાત. અમદાવાદ શફેરની સ્થાનિક મર્યાદામાં નવેમ્બર ૧૫, ૨૦૨૨ થી અમલમાં છે.

કપા કરીને તેની નોંધ લો.

શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ માટે સઢી/-

રમાકાંત ભોજનગરવાલા તારીખ : ૧૪.૧૧.૨૦૨૨ (મેનેજિંગ ડિરેક્ટર) (ડીઆઈએન: ૦૦૦૧૨૭૩૩) સ્થળ: અમદાવાદ

MUNOTH CAPITAL MARKET LIMITED

CIN: L99999GJ1986PLC083614

Regd. Office: Shanti Nivas, Opp. Shapath-V, Mr. Karnavati Club, S G Road, Ahmedabad-380058. E-mail: munoth@gmail.com: • Contact No.: 022-22843144, 22870278, 26937954 Statement of Unaudited financial results for the for the Quarter and Half year ended 30/9/2022

			(Rs. In Lakhs except EPS			
Sr. No.	Particulars	Quarter Ending on 30.09.2022	Year to Date Figures 31.03.2022	Corresponding Three Months Ended in the Previous Year 30.09.2021		
1	Total income from operations (net)	6.87	33.35	7.60		
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-1.56	13.49	2.94		
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	-1.56	13.49	2.94		
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-1.56	13.49	2.94		
5	Total Comprehensive income for the period (Comprising Profit for the period (after Tax) and other Comprehensive income (after Tax)	-2.78	16.01	3.07		
6	Equity Share Capital	449.55	449.55	449.55		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year)	36.71	38.18	29.07		
8	Earnings Per Share (before and after extraordinary items) Basic / Diluted:	-0.02	0.15	0.03		
9	Face Value of Equity Share Capital	5	5	5		

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e www.bseindia.com and company website www.munoth.com

For, Munoth Capital Market Limited

Siddharth Jain Director (DIN: 00370650) Date: 14-11-2022 Place: Ahmedabad

DOLFIN RUBBERS LIMITED

Regd. Office: 26 A, Bhai Randhir Singh Nagar, Ludhiana, Punjab-141012, CIN: L25112PB1995PLC017160 Email: dolfintube@gmail.com; Website: www.dolfin.co.in

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2022

Sr. Particulars

(₹ in Lakhs) Except per equity share data

DAURTER HALF YEAR YEAR

Sr. No.	Particulars	ENDED		ENDED		ENDED
				30.09.2022 (Unaudited)		31.03.202 (Audited)
1	Total Income from	2440.47	2333.32	4773.79	3757.28	8373.75
	Operations					
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	103.10	110.66	213.76	110.20	381.69
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	103.10	110.66	213.76	110.20	381.69
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	73.53	113.17	186.70	87.84	276.81
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	73.53	113.17	186.70	87.84	276.81
6	Equity Share Capital*2	1002.99	1002.99	1002.99	752.25	752.25
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year					1403.72
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.73	440	4.00	1.17	3.68
	Basic: Diluted:	0.73	1.13	1.86 1.86	1.17	3.68
	z. Dilutea:	0.73	1.13	1.86	1.17	3.68

filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosur Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results is available on the websites of the Stock Exchange(s) (www.bseindia.com) and the lister entity. (www.dolfin.co.in).

2. During the quarter the company has issued 2507396 shares of face value of Rs. 10 each

For DOLFIN RUBBERS LIMITED Sd/

Place : Ludhiana Date: 14 November, 2022

KAWALJIT SINGH Chairman & Managing Director DIN: 00942794

UNITED POLYFAB GUJARAT LIMITED Regd Office: Survey No. 238, 239, Shahwadi, Opp. New aarvee Denim, Narol-Sarkhej Highway, Ahmedabad-382 405

TATIVABRICATION DEVELOPERS LIMITED Ra**Tr**na

CIN: L45200GJ2006PLC048776

Regd. Office: S.F. 207, Turquoise, Panchvati Panch Rasta, Nr. White House E.B., C.G. Road, Ahmedabad-380009 Gujarat, India • Tel No : (079) 40056129 • Email: cs@ratnagroup.co.in • Website: www.ratnagroup.co.in;

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half year ended 30th September, 2022

		(Rupees in Lakhs except E			
Sr. No.	Particulars	Quarter ended 30-09-2022 (Unaudited)	Quarter ended 30-06-2022 (Unaudited)	Quarter ended 30-09-2021 (Unaudited)	Year Ende 31-03-202 (Audited)
1	Total Income from Operations	5.60	4.60	4.60	15.90
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(14.90)	(14.83)	(9.13)	(29.90)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(14.90)	(14.83)	(9.13)	(29.90)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(14.89)	(14.77)	(7.76)	(26.06)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	0.00	0.00	0.00	0.00
6	Equity Share Capital	1370.00	1370.00	1370.00	1370.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	2107.32
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) – 1. Basic: 2. Diluted:	(0.11) (0.11)	(0.11) (0.11)	(0.06) (0.06)	(0.19) (0.19)

a) The above is an extract of the detailed format of Quarterly Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the

₹ 11.40/- on stand-alone basis. (The amounts are mentioned in lakhs) For, Ratnabhumi Developers Limited

Mr. Kaivan Shah

Place: Ahmedabad

Quarterly Standalone and Consolidated Financial Results are available on the websites of the Stock Exchange at www.bseindia.comand the company at www.ratnagroup.co.in. b) The Turnover for the Quarter ended 30th September, 2022 is ₹ 31.88/-, Profit before tax is ₹ 11.39/- and Profit after Tax is

Chairman and Managing Director DIN: 01887130

Date: 14-11-2022

Date: November14, 2022

Particulars

Net Profit / (Loss) for the period (before Tax.

Net Profit / (Loss) for the period before tax

Net Profit / (Loss) for the period after tax

Total Comprehensive Income for the period

(after Exceptional and/or Extraordinary items)

(after Exceptional and/or Extraordinary items)

[Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]

Equity Share Capital (Face value of Rs. 10 Each)

Reserves (excluding Revaluation Reserve as

shown in the audited Balance Sheet of the

(for continuing and discontinued operations)

Basic: (not annualzed for the guarter ended)

Diluted: (not annualzed for the guarter ended)

Earnings Per Share (of Rs 10/- each)

Exceptional and/or Extraordinary items)

Total Income From Operations (net)

Place: Ahmedabad નિખીલ કાગા કંપની સેક્રેટરી

सही/

www.upgl.in.

previous year)